



ગ્રામીણ કૃષિ મૌસમ સેવા  
હવામાન આગાહી આધારીત કૃષિ સલાહ બુલેટીન  
ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ  
તા. ૧૯-૦૮-૨૦૧૫ થી તા. ૨૩-૦૮-૨૦૧૫



(ગ્રામીણ કૃષિ મૌસમસેવા, સૂકી ખેતી સંશોધનકેન્દ્ર, જી.કૃ.યુ., તરઘડીયા અને ભારત મૌસમ વિભાગ દ્વારા સંપન્ન)

કૃષિ હવામાન બુલેટીન નં. ૪૧/૨૦૧૫

પાછલા અઠવાડીયાનું રાજકોટનું હવામાન

હવામાન પરિબલો	ઉત્તર સૌરાષ્ટ્ર
વરસાદ (મી.મી)	4.8
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	30.8-32.7
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	24.2-25.2
ભેજ (%) સવાર	84-89
ભેજ (%) બપોરબાદ	57-71
પવનની ગતિ (કિમી/કલાક)	1.1-3.7

હવામાન આગાહી: પત્રક-ક

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ-હવામાન આગાહી

તા. ૧૯-૦૮-૨૦૧૫ થી તા. ૨૩-૦૮-૨૦૧૫

કૃષિ સલાહ:

સામાન્ય	ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવે છે કે, ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના																																																												
	<p>૧. રાજકોટ: જીલ્લામાં આગામી તા. ૧૯-૦૮-૨૦૧૫ થી તા. ૨૩-૦૮-૨૦૧૫ દરમિયાન હવામાન ભેજવાળું, મુખ્યત્વે વાદળ ધારૂં રહેશે અને વરસાદની શક્યતા નથી. પવનની દિશા નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૨૦ થી ૨૮ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રિ દરમિયાન ૨૫ થી ૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.</p>																																																												
	<table border="1"><thead><tr><th>તારીખ</th><th>દિવસ-૧</th><th>દિવસ-૨</th><th>દિવસ-૩</th><th>દિવસ-૪</th><th>દિવસ-૫</th></tr><tr><th>પેરામીટર</th><th>૧૯-૦૮-૧૫</th><th>૨૦-૦૮-૧૫</th><th>૨૧-૦૮-૧૫</th><th>૨૨-૦૮-૧૫</th><th>૨૩-૦૮-૧૫</th></tr></thead><tbody><tr><td>વરસાદ (મી.મી)</td><td>2</td><td>0</td><td>0</td><td>0</td><td>0</td></tr><tr><td>મહત્તમ તાપમાન (સે.ગ્રે)</td><td>32</td><td>32</td><td>33</td><td>33</td><td>33</td></tr><tr><td>લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)</td><td>25</td><td>25</td><td>26</td><td>26</td><td>26</td></tr><tr><td>વાદળની સ્થિતિ (ઓકટા)</td><td>5</td><td>6</td><td>6</td><td>7</td><td>6</td></tr><tr><td>મહત્તમ ભેજ (%) સવાર</td><td>82</td><td>80</td><td>81</td><td>81</td><td>82</td></tr><tr><td>લઘુત્તમ ભેજ (%) બપોરબાદ</td><td>60</td><td>60</td><td>67</td><td>69</td><td>66</td></tr><tr><td>પવનની ગતિ (કિમી/કલાક)</td><td>20</td><td>27</td><td>27</td><td>28</td><td>26</td></tr><tr><td>પવનની દિશા (ડીગ્રી)</td><td>240</td><td>244</td><td>244</td><td>248</td><td>247</td></tr></tbody></table>	તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫	પેરામીટર	૧૯-૦૮-૧૫	૨૦-૦૮-૧૫	૨૧-૦૮-૧૫	૨૨-૦૮-૧૫	૨૩-૦૮-૧૫	વરસાદ (મી.મી)	2	0	0	0	0	મહત્તમ તાપમાન (સે.ગ્રે)	32	32	33	33	33	લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	25	25	26	26	26	વાદળની સ્થિતિ (ઓકટા)	5	6	6	7	6	મહત્તમ ભેજ (%) સવાર	82	80	81	81	82	લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	60	60	67	69	66	પવનની ગતિ (કિમી/કલાક)	20	27	27	28	26	પવનની દિશા (ડીગ્રી)	240	244	244	248	247
તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫																																																								
પેરામીટર	૧૯-૦૮-૧૫	૨૦-૦૮-૧૫	૨૧-૦૮-૧૫	૨૨-૦૮-૧૫	૨૩-૦૮-૧૫																																																								
વરસાદ (મી.મી)	2	0	0	0	0																																																								
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	32	32	33	33	33																																																								
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	25	25	26	26	26																																																								
વાદળની સ્થિતિ (ઓકટા)	5	6	6	7	6																																																								
મહત્તમ ભેજ (%) સવાર	82	80	81	81	82																																																								
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	60	60	67	69	66																																																								
પવનની ગતિ (કિમી/કલાક)	20	27	27	28	26																																																								
પવનની દિશા (ડીગ્રી)	240	244	244	248	247																																																								

**૨.જામનગર:** જીલ્લામાં આગામીતા.૧૯-૦૮-૨૦૧૫ થી તા.૨૩-૦૮-૨૦૧૫દરમ્યાન હવામાન ભેજવાળુ, મુખ્યત્વે વાદળછાયું રહેશે અને વરસાદની શક્યતા નથી. પવનની દિશા નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૨૩ થી ૩૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રિ દરમ્યાન ૨૫ થી ૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૧૯-૦૮-૧૫	૨૦-૦૮-૧૫	૨૧-૦૮-૧૫	૨૨-૦૮-૧૫	૨૩-૦૮-૧૫
વરસાદ (મી.મી)	2	0	0	0	0
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	32	32	33	33	33
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	25	25	26	26	26
વાદળની સ્થિતિ (ઓકટા)	5	6	6	7	6
મહત્તમ ભેજ (%) સવાર	81	79	79	80	80
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	65	64	69	73	69
પવનની ગતિ (કિમી/કલાક)	23	31	30	30	29
પવનની દિશા (ડીગ્રી)	239	247	246	248	247





**અમરેલી:**જીલ્લામાં આગામીતા.૧૯-૦૮-૨૦૧૫ થી તા.૨૩-૦૮-૨૦૧૫દરમ્યાન હવામાન ભેજવાળુ, મુખ્યત્વે વાદળછાયું રહેશે અને તા.૧૯-૨૦ દરમ્યાન હળવા વરસાદની શક્યતા છે. પવનની દિશા નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૮ થી ૨૫ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રિ દરમ્યાન ૨૬ થી ૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.





તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૧૯-૦૮-૧૫	૨૦-૦૮-૧૫	૨૧-૦૮-૧૫	૨૨-૦૮-૧૫	૨૩-૦૮-૧૫
વરસાદ (મી.મી)	3	2	0	0	0
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	33	33	32	32	32
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	26	26	27	27	26
વાદળની સ્થિતિ (ઓકટા)	5	6	5	6	5
મહત્તમ ભેજ (%) સવાર	84	81	81	82	83
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	61	61	66	70	65
પવનની ગતિ (કિમી/કલાક)	18	23	25	26	24
પવનની દિશા (ડીગ્રી)	243	243	243	248	247

**સુરેન્દ્રગર:**જીલ્લામાં આગામીતા.૧૯-૦૮-૨૦૧૫ થી તા.૨૩-૦૮-૨૦૧૫દરમ્યાન હવામાન ભેજવાળુ, મુખ્યત્વે વાદળછાયું રહેશે અને વરસાદની શક્યતા નથી. પવનની દિશા નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૨૦ થી ૨૬ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રિ દરમ્યાન ૨૬ થી ૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૧૯-૦૮-૧૫	૨૦-૦૮-૧૫	૨૧-૦૮-૧૫	૨૨-૦૮-૧૫	૨૩-૦૮-૧૫
વરસાદ (મી.મી)	3	2	0	0	0
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	33	33	32	32	32
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	26	26	27	27	26
વાદળની સ્થિતિ (ઓકટા)	6	5	6	6	6
મહત્તમ ભેજ (%) સવાર	79	77	77	78	80
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	54	54	62	64	63
પવનની ગતિ (કિમી/કલાક)	20	26	24	25	22
પવનની દિશા (ડીગ્રી)	239	240	239	242	238

- આગામી તા.૧૯ અને ૨૩ ઓગષ્ટ દરમ્યાન છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

<ul style="list-style-type: none"> <li>મગફળી, કપાસ, તલ, અરંડા, કઠોળ પાકમાં આંતરખેડ અને નિંદામણ કરવું.</li> <li>આ હવામાન પરિસ્થિતિમાં રોગ અને જીવાતના ઉપદ્રવની શક્યતા હોવાથી પાકનું સતત નિરીક્ષણ કરતા રહીને જરૂરીયાત મુજબ પાક સંરક્ષણના પગલા ભરવા.</li> </ul>			
મુખ્ય પાક	પાક અવસ્થા	રોગ/જીવાત/જાત	કૃષિ સલાહ (૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભલામણ કરેલ દવા છાંટવી)
મગફળી	ફુલ, સૂચા અને પોપટા બંધાવા	લીલી ઈયળ →  મોલો (ગરો) →  સફેદ વેણ (મુંડા) Æ 	આંતરખેડ કરવી અને નિંદામણ કરવું. – લીલી ઈયળના નિયંત્રણ માટે જો ભેજવાળું હવામાન હોય તો બીવેરીયા બેસીયાના ફુગના ૪૦ ગ્રામ પાવડરનો ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો અથવા – ૨૫૦ લારવલ યુનીટ/૨.૫ વિઘા એન.પી.વી. કલ્ચરનો છંટકાવ કરવો. અથવા રીનાક્ષીપાયર૩ મીલી દવાનો છંટકાવ વરાપ હોય ત્યારે કરવો. મોલોના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા ૫ મી.લી. અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. અથવા થાયોમીથોકઝામ ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર છાંટવી. જો મોલોને ખાનાર દાળીયાની વસ્તી વધારે હોય તો દવા છાંટવાનું મુલત્વી રાખવું. ફોરેટ ૧૦ ટકા દાણાદાર દવા ૪ કિ.ગ્ર./વિઘા જમીનમાં આપવી અથવા કલોરપાયરીફોસ દવા હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે આપવી અથવા કલોરપાયરીફોસ દવા ૨૫ મીલી. ૧૦ લિટર પાણીમાં અગાળી આ પ્રવાહી મિશ્રણને છોડના મુળ પાસે અને જમીનમાં ઉતરે તે રીતે પંપની નોઝલ કાઢી રેડવાથી (ડ્રિ-ચીંગ) નિયંત્રણ મેળવી શકાય છે. પાનના ટપકાના રોગના આગોતરા નિયંત્રણ માટે હેકઝાકોનાઝોલ ૧૫ મી.લી. અથવા ટેબ્યુકોનાઝોલ ૧૦ મી.લી. નો છંટકાવ વરાપ હોય ત્યારે કરવો.
કપાસ	ચાંપવા અને ફુલ	શ્રીપ્સ Æ	આંતરખેડ કરવી અને નિંદામણ કરવું. નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૨૦ મી.લી. અથવા ફીપ્રોનીલ ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર છાંટવી.
તલ	ફુલ અને બૈઠા બેસવા	પાન વાળનાર ઈયળ Æ 	કિવનાલફોસ ૨૦ મી.લી. અથવા કારટેપ હાયડ્રોકલોરાઈડ ૧૫ ગ્રામ ૧૦ લી પાણીમાં મિશ્ર કરી છાંટવી. હુફાળા ભેજવાળા વાતાવરણના કારણે પાન કથીરીનો ઉપદ્રવ હોય તો પ્રોપરગાઈટ દવા ૧૦ મીલી ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છાંટવી.
અરંડા	વૃદ્ધિ/ફુલ	ઘોડીયા ઈયળ Æ	તેના નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૦ મીલી ૧૦ લી પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

			
બાજરી	નિંઘલ	—	૮૮ કિ.ગ્રા. યુરિયા પ્રતિ હેક્ટરે પુર્તિ ખાતર તરીકે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું.
કઠોળ પાકો	ફુલ અને શીંગો બેસવી	લીલી અને લશ્કરી ઈયળ $\bar{E}$ 	તેના નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૦ મીલી અથવા કોરાજન ૩ મીલી ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.
શાકભાજી	ઘરૂં રોપણી	જો રોપ તૈયાર હોય તો મરચી, ટમેટી, રીંગણ અને કોબીઝની રોપણી કરવી.	
રીંગણી અને ટમેટી	ફુલ/ફળ	સફેદ માખી  ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ $\bar{E}$	<ul style="list-style-type: none"> <li>▶ લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦ લી પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ હોય તો એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.</li> <li>▶ ડુળા અને ડાકાળા ઇવળાળા ઉપપ્રવ હાલ ત ગુજરાત પામેલ ડુળા અને ડાકા તો જમીનમાં દાંટી દેવા અને રાનિક્ષાપાવર દવા ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.</li> </ul>
મરચી	ફુલ/ફળ	પાનની કુકડ-શ્રીપ્સ $\bar{E}$   પાનની કુકડ-વાયરસ $\bar{E}$ 	<p>પ્રોફેનોફોસ ૨૦ મી.લી. અને લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦ લી પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.</p> <p>વાયરસના કારણે પીળા થઈ કુકડાય ગયેલ છોડ ઉપારી તેનો જમીનમાં દાટી નાશ કરવો. ત્યાં સફેદ માખીથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે હોસ્ટાથીયોન દવા ૨૦ મી.લી./૧૦ લી. પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.</p>
ભીંડા	ફુલ/ફળ	યુસીયા તથા ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ $\bar{E}$	તેના નિયંત્રણ માટે એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ અને લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી /૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો ટ્રાયજોફોસ ૪૦ ટકા ૨૦ મીલી/૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.
ગુવાર	વૃદ્ધિ/ફુલ/શીંગ	શ્રીપ્સ, સફેદ માખી	લીંબોળીનો અર્ક ૫૦૦ મીલી અથવા લીંબોળીનું તેલ ૫૦

			<p>મીલીનો છંટકાવ ૧૫ દિવસના અંતરે ચાર વખત કરવો. વધુ ઉપદ્રવ હોય તો ટ્રાયજોફોસ ૪૦ ટકા ૨૦ /૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.</p> <p>મેન્કોઝેક ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૨૭ ગ્રામ અથવા ફોઝેટાઈલ ૨૦ ગ્રામના ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.</p>
લીબુ	ફળ વિકાસ	બદામી ટપકા પાનકોરીયુ	કોપર ઓકઝીકલોરાઈડ ૪૦ ગ્રામ અને ૧.૫ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનના બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરવા ડીડીવીપી ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છાંટવી.
પશુ/મરઘા	<p>ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રાઝ ૨ મી.લી. એક લીટર પાણીમાં નાખીને છાંટવી. વીટામીન એ તથા ડી પુરકો આપવા. કરચિમયાની દવા, ટી.બી તથા જે.ડી ના રોગની પરખ કરાવવી. વરસાદના સમયે પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા. ચોમાસા દરમ્યાન જાનવરોની રહેઠાણની જગ્યાની વ્યવસ્થિત સફાઈ તેમજ માખીઓના ઉપદ્રવથી બચવા ફિનાઈલ છાંટવું.</p> <p>મરઘા ઘરમાં ઈંડાનું ઉત્પાદન જાળવી રાખવા મરઘા ઘરમાં કૃત્રિમ રોશનીની વ્યવસ્થા કરવી.</p>		

જા.નં.જુકૃયુ/સંવે(સુખે)/એગ્રોમેટ/બુલેટીન/ /૨૦૧૫  
તરઘડીયા( રાજકોટ), તારીખ:૧૮/૦૮/૨૦૧૫.

પ્રતિ,  
તંત્રીશ્રી/ ડાયરેક્ટરશ્રી,  
રાજકોટ.

ઉપરોક્ત માહિતી આપના દૈનિક સમાચાર પત્રોમાં, રેડિયોમાં ગામના ચોરાના કાર્યક્રમમાં તથા ટીવીના ગ્રામ્ય કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રસિધ્ધ કરવા નમ્ર વિનંતી છે. સહકારની અપેક્ષા સહ આભાર.

સંશોધન વૈજ્ઞાનિક (સૂકી ખેતી)  
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી  
તરઘડીયા



**Gramin Krushi Mausam Seva  
Main Dry Farming Research Station  
Junagadh Agricultural University  
Targhadia (Rajkot) - 360 003  
Phone: (0281)2784260(O), 2331686(R)  
Fax : ( 0281)2784722, Cell :94277 28523**



**Agro met Advisory Service bulletin No.-41 for the Rajkot district**

(Issued jointly by DFRS, J.A.U., Targhadia (Rajkot) and India Meteorological Department)  
(Period 19<sup>th</sup> to 23<sup>rd</sup> Aug.- 2015)

**Significant past weather for the preceding week of Rajkot**

Rainfall (mm)	4.8
Maximum temperature (°C )	30.8-32.7
Minimum temperature (°C )	24.2-25.2
Relative Humidity (%) I	84-89
Relative Humidity (%) II	57-71
Wind speed (Kmph)	1.1-3.7





**Weather forecast until 08-30 hrs of 23/08/2015**




**(1) RAJKOT DISTRICT:**

	19/08/15	20/08/15	21/08/15	22/08/15	23/08/15
Rainfall (mm)	2	0	0	0	0
Max.Temp.(°C)	32	32	33	33	33
Min.Temp.(°C)	25	25	26	26	26
Total CC (octa)	5	6	6	7	6
RH-I (%)	82	80	81	81	82
RH-II (%)	60	60	67	69	66
Wind Speed (kmph)	20	27	27	28	26
Wind Direction(deg.)	240	244	244	248	247

**Agro meteorological Advisories:**

<b>General Advice</b>	<ul style="list-style-type: none"> <li>• <b>Rain fall:</b> Humid and generally cloudy to cloudy weather forecasted for next five days and light rain fall forecasted on 19.8.2015.</li> <li>• <b>Temperature:</b> Maximum and minimum temperature likely to be in range of 33-33 and 25-26°c, respectively.</li> <li>• <b>Relative Humidity:</b> The RH is likely to be in the range of 60-82 %</li> <li>• <b>Wind Direction and Speed:</b> Direction and speed of wind is likely to be SW and 20-28 km/h, respectively.</li> <li>• <b>Monitor the crops for heliothis, prodenia, thrips and jassids infestation and if infestation observe above ETL then take control measures.</b></li> <li>• <b>Carry out interculturing and weeding operation to conserve soil moisture.</b></li> </ul>		
<b>Crops</b>	<b>Stage</b>	<b>Insect/Pest/Variety</b>	<b>Advisory</b>

<b>Kharif groundnut</b>	Flowering/ Pegging/ pod formation	Heliiothis& Aphid   White grub 	<b>Heavy infestation of heliothis observed in groundnut, so spray Beauveriabassiana 40 gm in 10 liters of water or 250 larval unit of NPV solution per acre.</b> <b>or renaxypyr 3 ml in 10 liters of water under clear sky.</b> <b>For the control of aphid spray Imidacloprid 17.8 % 5 ml or Thiomethoxam 3 gram or Dimethoate 10 ml in 10 liters of water. If population of lady bird beetle is more then do not spray insecticide.</b>  Do soil application of Phorate 10 G 25 kg/ha or Drenching of Chlorpyrifos or Quinalphos 4 liters/ha. <b>For prevention of leaf spot disease spray Hexaconazole 10 ml OR Tebuconazole 7 ml in 10 liters of water under clear sky.</b>
<b>Cotton</b>	squaring & flowering initiation	Thrips→	Under present weather condition thrips infestation observed above ETL. So spray 20 ml fipronil or 20 ml profenophosin 10 litres of water.
<b>Sesame</b>	Flowering & capsule formation	-	There may be chance of mite infestation, so monitor the crop for the pest, if mite infestation found then spray propargite 57 % EC 10 ml in 10 liters of water for control of mites infestation.
<b>Pearl millet</b>	Panicle initiation	-	-
<b>Castor</b>	Growing/ flowering	Semi looper & prodenia→ 	Heavy infestation of semilooper observed in castor, so spray Chlorpyro phos 30 ml in 10 liters of water.
<b>Pulses</b>	Flowering & pod formation	Heliiothis prodenia and 	<b>Heavy infestation of heliothis observed in pulses, so spray Beauveriabassiana 40 gm in 10 liters of water or 250 larval unit of NPV solution per acre.</b> <b>or renaxypyr 3 ml in 10 liters of water under clear sky.</b>
<b>Vegetables</b>	Transplanting	Transplanting of brinjal, chilli and early cauliflower are advised for those farmers whose seedlings are ready.	

<b>Lady's finger</b>	Flowering/ fruiting	Shoot and fruit borer  Mites	Spray neem seed extract 500 ml or neem seed oil 50 ml in 10 litre of water at 15 days interval (4 spray) Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised. Due to prevailing high temperature, light irrigation at short interval is advised.
<b>Brinjal</b>	Flowering/ fruiting	<b>Sucking pest</b> & Fruit-shoot borer  Mites	To control them spray <b>neem seed extract</b> 5 % or neem seed oil 50 ml and <b>acetamiprid</b> 20 % SP @ 5.0 gm / 10 lit of water at 15 days interval. Collect damaged fruits and buried deep in soil. If pest population is high, spraying of renaxypyre @ 3 ml / 10liters of water is advised. Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised.
<b>Chili</b>	Flowering & fruiting	<b>Leaf curling</b> <b>Thrips</b>   <b>Virus</b> 	In present weather conditions severe attack of thrips has been reported. Spray 20 ml <b>profenofosin</b> 10 litres of water.  In present weather conditions, rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of Imidacloprid @ 5 ml per 10litre of water is advised for control the vector, when sky remains clear.
<b>Lemon</b>	Fruit development	Citrus canker  Leaf minor	Spray copper oxychloride 40 gm or streptocyclie 1.5 gm in 10 litre of water Spray Dichlorvosh 10 ml or Quinalphos 20 ml in 10 litres of water for control of leaf minor
<b>Livestock &amp; poultry</b> 	Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Deworming, T.B. and J.D. Testing should be done. Do Brucellous calfwood vaccination. Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. Due to chance of rainfall keep animals indoors during rainfall. Keep fodder in safe place to avoid spoilage due to rainfall. Ensure regarding vaccination of animals for different diseases in rainy season. Spray phenyl in the animal shed to avoid fly's and mosquitoes.		

**Technical Officer, GKMS Unit, DFRS, JAU, Targhadia.**





**Gramin Krushi Mausam Seva**  
**Main Dry Farming Research Station**  
**Junagadh Agricultural University**  
**Targhadia (Rajkot) - 360 003**  
**Phone: (0281)2784260(O), 2331686(R)**  
**Fax : ( 0281)2784722, Cell :94277 28523**



**Agro met Advisory Service bulletin No.-41 for the Jamnagar district**

(Issued jointly by DFRS, J.A.U., Targhadia (Rajkot) and India Meteorological Department)


(Period 19<sup>th</sup> to 23<sup>rd</sup> Aug.- 2015)






**Weather forecast until 08-30 hrs of 23/08/2015**




**(2) JAMNAGAR DISTRICT:**

	19/08/15	20/08/15	21/08/15	22/08/15	23/08/15
Rainfall (mm)	2	0	0	0	0
Max.Temp.(°C)	32	32	33	33	33
Min.Temp.(°C)	25	25	26	26	26
Total CC (octa)	5	6	6	7	6
RH-I (%)	81	79	79	80	80
RH-II (%)	65	64	69	73	69
Wind Speed (kmph)	23	31	30	30	29
Wind Direction(deg.)	239	247	246	248	247

**Agro meteorological Advisories:-**

<b>General Advice</b>	<ul style="list-style-type: none"> <li>• <b>Rain fall:</b> Humid and generally cloudy to cloudy weather forecasted for next five days and light rain fall forecasted on 19.8.2015.</li> <li>• <b>Temperature:</b> Maximum and minimum temperature likely to be in range of 32-33 and 25-26 °c, respectively.</li> <li>• <b>Relative Humidity:</b> The RH is likely to be in the range of 64-81 %</li> <li>• <b>Wind Direction and Speed:</b> Direction and speed of wind is likely to be SW &amp; Wand 23-31 km/h, respectively.</li> <li>• <b>Monitor the crops for heliothis and jassids infestation and if infestation observe above ETL then take control measures.</b></li> <li>• <b>Carry out interculturing and weeding operation to conserve soil moisture.</b></li> <li>• <b>Apply supplementary irrigation to cotton and groundnut crop due to prolong dry spell.</b></li> </ul>			
<b>Crops</b>	<b>Stage</b>	<b>Insect/Pest/Variety</b>	<b>Advisory</b>	
<b>Kharif groundnut</b>	Flowering/ Pegging/ pod formation	Heliothis& Aphid 	<p><b>Heavy infestation of heliothis observed in groundnut, so spray Beauveria bassiana 40 gm in 10 liters of water or 250 larval unit of NPV solution per acre.</b></p> <p><b>orrenaxypr 3 ml in 10 liters of water under clear sky.</b></p> <p><b>For the control of aphid spray Imidacloprid 17.8 % 5 ml or Thiomethoxam 3 gram or Dimethoate 10</b></p>	

		 <p><b>White grub</b></p> 	<p><b>ml in 10 liters of water. If population of lady bird beetle is more then do not spray insecticide.</b></p> <p>Do soil application of Phorate 10 G 25 kg/ha or Drenching of Chlorpyrifos or Quinalphos 4 liters/ha.</p> <p><b>For prevention of leaf spot disease spray Hexaconazole 10 ml OR Tebuconazole 7 ml in 10 liters of water under clear sky.</b></p>
<b>Cotton</b>	squaring & flowering initiation	Thrips→	Under present weather condition thrips infestation observed above ETL. So spray 20 ml fipronil or 20 ml profenophosin 10 litres of water.
<b>Sesame</b>	Flowering& capsule formation	-	There may be chance of mite infestation, so monitor the crop for the pest, if mite infestation found then spray propargite 57 % EC 10 ml in 10 liters of water for contril of mites infestation.
<b>Pearl millet</b>	Panicle initiation	-	-
<b>Castor</b>	Growing/ flowering	Semi looper & prodenia→ 	Heavy infestation of semilooper observed in castor, so spray Chlorpyro phos 30 ml in 10 liters of water.
<b>Pulses</b>	Flowering & pod formation	Heliothis prodenia and  	<b>Heavy infestation of heliothis observed in pulses, so spray Beauveriabassiana40 gm in 10 liters of water or 250 larval unit of NPV solutionper acre.</b> <b>orrenaxypr 3 ml in 10 liters of water under clear sky.</b>
<b>Vegetables</b>	Transplantin g	Transplanting of brinjal, chilli and early cauliflower are advised for those farmers whose seedlings are ready.	
<b>Lady's finger</b>	Flowering/ fruiting	Shoot and fruit borer  Mites	Sparry neem seed extract 500 ml or neem seed oil 50 ml in 10 litre of water at 15 days interval(4 spray) Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised. Due to prevailing high temperature, light irrigation at short interval is advised.
<b>Brinjal</b>	Flowering/fr uiting	<b>Sucking pest</b> & Fruit-shoot borer	To control them spray <b>neem seed extract 5 %</b> or neem seed oil 50 ml and <b>acetamiprid 20 % SP@</b>

		Mittes	5.0 gm / 10 lit of water at 15 days interval. Collect damaged fruits and buried deep in soil. If pest population is high, spraying of renaxypyre @3 ml /10liters of water is advised. Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised.
<b>Chili</b>	Flowering & fruiting	<b>Leaf curling</b> <b>Thrips</b>  <b>Virus</b> 	<p>In present weather conditions severe attack of thrips has been reported. Spray 20 ml profenofosin 10 litres of water.</p> <p>In present weather conditions, rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of Imidacloprid @ 5 ml per 10litre of water is advised for control the vector, when sky remains clear.</p>
<b>Lemon</b>	Fruit development	Citrus canker Leaf minor	Spray copper oxychloride 40 gm or streptocyclie 1.5 gm in 10 litre of water Spray Dichlorvosh 10 ml or Quinalphos 20 ml in 10 litres of water for control of leafminor
<b>Livestock &amp; poultry</b> 	Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Deworming, T.B. and J.D. Testing should be done. DoBrucellousiscalfwood vaccination. Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. Due to chance of rainfall keep animals indoors during rainfall. Keep fodder in safe place to avoid spoilage due to rainfall. Ensure regarding vaccination of animals for different diseases in rainy season. Spray phenyl in the animal shed to avoid fly's and mosquitoes.		

**Technical Officer, GKMS Unit, DFRS, JAU, Targhadia.**



**Gramin Krushi Mausam Seva**  
**Main Dry Farming Research Station**  
**Junagadh Agricultural University**  
**Targhadia (Rajkot) - 360 003**  
**Phone: (0281)2784260(O), 2331686(R)**  
**Fax : ( 0281)2784722, Cell :94277 28523**



**Agro met Advisory Service bulletin No.41 for the Amreli district**

(Issued jointly by DFRS, J.A.U., Targhadia (Rajkot) and India Meteorological Department)


(Period 19<sup>th</sup> to 23<sup>rd</sup> Aug.- 2015)




**Weather forecast until 08-30 hrs of 23/08/2015**




**(3) AMRELI DISTRICT:**

	19/08/15	20/08/15	21/08/15	22/08/15	23/08/15
Rainfall (mm)	3	2	0	0	0
Max.Temp.(°C)	33	33	32	32	32
Min.Temp.(°C)	26	26	27	27	26
Total CC (octa)	5	6	5	6	5
RH-I (%)	84	81	81	82	83
RH-II (%)	61	61	66	70	65
Wind Speed (kmph)	18	23	25	26	24
Wind Direction(deg.)	243	243	243	248	247

**Agro meteorological Advisories:**

<b>General Advice</b>	<ul style="list-style-type: none"> <li>• <b>Rain fall:</b> Humid and generally cloudy to cloudy weather forecasted for next five days. Light rainfall is forecasted on date 19/20-8-2015.</li> <li>• <b>Temperature:</b> Maximum and minimum temperature likely to be in range of 32-33 and 26-27 °c, respectively.</li> <li>• <b>Relative Humidity:</b> The RH is likely to be in the range of 61-84 %</li> <li>• <b>Wind Direction and Speed:</b> Direction and speed of wind is likely to be SW and 18-24 km/h, respectively.</li> <li>• <b>Monitor the crops for heliothis and jassids infestation and if infestation observe above ETL then take control measures.</b></li> <li>• <b>Carry out interculturing and weeding operation to conserve soil moisture.</b></li> </ul>		
<b>Crops</b>	<b>Stage</b>	<b>Insect/Pest/Variety</b>	<b>Advisory</b>
<b>Kharif groundnut</b>	Flowering/ Pegging/ pod formation	Heliothis & Aphid  White grub	<b>Heavy infestation of heliothis observed in groundnut, so spray Beauveria bassiana 40 gm in 10 liters of water or 250 larval unit of NPV solution per acre.</b> <b>orrenaxypr 3 ml in 10 liters of water under clear sky.</b> <b>For the control of aphid spray Imidacloprid 17.8 % 5 ml or Thiomethoxam 3 gram or Dimethoate 10 ml in 10 liters of water. If population of lady bird beetle is more then do not spray insecticide.</b>

			Do soil application of Phorate 10 G 25 kg/ha or Drenching of Chlorpyrifos or Quinalphos 4 liters/ha. <b>For prevention of leaf spot disease spray Hexaconazole 10 ml OR Tebuconazole 7 ml in 10 liters of water under clear sky.</b>
<b>Cotton</b>	squaring & flowering initiation	Thrips→	Under present weather condition thrips infestation observed above ETL. So spray 20 ml fipronil or 20 ml profenophosin 10 litres of water.
<b>Sesame</b>	Flowering& capsule formation	-	There may be chance of mite infestation, so monitor the crop for the pest, if mite infestation found then spray propargite 57 % EC 10 ml in 10 liters of water for contril of mites infestation.
<b>Pearl millet</b>	Panicle initiation	-	-
<b>Castor</b>	Growing/ flowering	Semi looper & prodenia→ 	Heavy infestation of semilooper observed in castor, so spray Chlorpyro phos 30 ml in 10 liters of water.
<b>Pulses</b>	Flowering & pod formation	Heliiothis prodenia and 	<b>Heavy infestation of heliothis observed in pulses, so spray Beauveriabassiana40 gm in 10 liters of water or 250 larval unit of NPV solutionper acre. orrenaxypr 3 ml in 10 liters of water under clear sky.</b>
<b>Vegetables</b>	Transplantin g	Transplanting of brinjal, chilli and early cauliflower are advised for those farmers whose seedlings are ready.	
<b>Lady's finger</b>	Flowering/ fruiting	Shoot and fruit borer  Mites	Spary neem seed extract 500 ml or neem seed oil 50 ml in 10 litre of water at 15 days interval(4 spray) Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised. Due to prevailing high temperature, light irrigation at short interval is advised.
<b>Brinjal</b>	Flowering/fr uiting	<b>Sucking pest</b> & Fruit-shoot borer	To control them spray <b>neem seed extract</b> 5 % or neem seed oil 50 ml and <b>acetamiprid</b> 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval. Collect damaged fruits and buried deep in soil. If pest

		Mittes	population is high, spraying of renaxypyre @3 ml /10liters of water is advised. Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised.
<b>Chili</b>	Flowering & fruiting	<b>Leaf curling</b> <b>Thrips</b> Æ  <b>Virus</b> Æ	In present weather conditions severe attack of thrips has been reported. Spray 20 ml <b>profenofosin</b> 10 litres of water.  In present weather conditions, rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of Imidacloprid @ 5 ml per 10litre of water is advised for control the vector, when sky remains clear.
<b>Lemon</b>	Fruit development	Citrus canker Leaf minor	Spray copper oxychloride 40 gm or streptocyclie 1.5 gm in 10 litre of water Spray Dichlorvosh 10 ml or Quinalphos 20 ml in 10 litres of water for control of leafminor
<b>Livestock &amp; poultry</b> 	Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Deworming, T.B. and J.D. Testing should be done. DoBrucellousiscalfwood vaccination. Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. Due to chance of rainfall keep animals indoors during rainfall. Keep fodder in safe place to avoid spoilage due to rainfall. Ensure regarding vaccination of animals for different diseases in rainy season. Spray phenyl in the animal shed to avoid fly's and mosquitoes.		

**Technical Officer, GKMS Unit, DFRS, JAU, Targhadia.**



**Gramin Krushi Mausam Seva**  
**Main Dry Farming Research Station**  
**Junagadh Agricultural University**  
**Targhadia (Rajkot) - 360 003**  
**Phone: (0281)2784260(O), 2331686(R)**  
**Fax : (0281)2784722, Cell:94277 28523**



**Agro met Advisory Service bulletin No.-41 for the Surendranagar district**

(Issued jointly by DFRS, J.A.U., Targhadia (Rajkot) and India Meteorological Department)


(Period 19<sup>th</sup> to 23<sup>rd</sup> Aug.- 2015)




**Weather forecast until 08-30 hrs of 23/08/2015**

**(4) SURENDRANAGAR DISTRICT:**





	19/08/15	20/08/15	21/08/15	22/08/15	23/08/15
Rainfall (mm)	3	2	0	0	0
Max.Temp.(°C)	33	33	32	32	32
Min.Temp.(°C)	26	26	27	27	26
Total CC (octa)	6	5	6	6	6
RH-I (%)	79	77	77	78	80
RH-II (%)	54	54	62	64	63
Wind Speed (kmph)	20	26	24	25	22
Wind Direction(deg.)	239	240	239	242	238

**Agro meteorological advisories:**

<b>General Advice</b>	<ul style="list-style-type: none"> <li>● <b>Rain fall:</b> Humid and generally cloudy weather and forecasted for next five days. Light rainfall is forecasted on date 19/20-8-2015.</li> <li>● <b>Temperature:</b> Maximum and minimum temperature likely to be in range 32-33 and 26-27 °c, respectively.</li> <li>● <b>Relative Humidity:</b> The RH is likely to be in the range of 54-80 %</li> <li>● <b>Wind Direction and Speed:</b> Direction and speed of wind is likely to be SW and 20-26 km/h, respectively.</li> <li>● <b>Carry out interculturing and weeding operation to conserve soil moisture at vapsa condition.</b></li> <li>● <b>Apply supplementary irrigation to cotton and groundnut crop due to prolonged dry spell.</b></li> </ul>		
<b>Crops</b>	<b>Stage</b>	<b>Insect/Pest/Variety</b>	<b>Advisory</b>
<b>Kharif groundnut</b>	Flowering/ Pegging/ pod formation	Heliothis & Aphid 	<p><b>Heavy infestation of heliothis observed in groundnut, so spray Beauveria bassiana 40 gm in 10 liters of water or 250 larval unit of NPV solution per acre.</b></p> <p><b>or renaxypyr 3 ml in 10 liters of water under clear sky.</b></p> <p><b>For the control of aphid spray Imidacloprid 17.8 % 5 ml or Thiomethoxam 3 gram or Dimethoate 10 ml in 10 liters of water. If population of lady bird beetle is more than do not spray insecticide.</b></p>

		<b>White grub</b> 	<p>Do soil application of Phorate 10 G 25 kg/ha or Drenching of Chlorpyrifos or Quinalphos 4 liters/ha.</p> <p><b>For prevention of leaf spot disease spray Hexaconazole 10 ml OR Tebuconazole 7 ml in 10 liters of water under clear sky.</b></p>
<b>Cotton</b>	squaring & flowering initiation	Thrips→	Under present weather condition thrips infestation observed above ETL. So spray 20 ml fipronil or 20 ml profenophosin 10 litres of water.
<b>Sesame</b>	Flowering& capsule formation	-	There may be chance of mite infestation, so monitor the crop for the pest, if mite infestation found then spray propargite 57 % EC 10 ml in 10 liters of water for contril of mites infestation.
<b>Pearl millet</b>	Panicle initiation	-	-
<b>Castor</b>	Growing/ flowering	Semi looper & prodenia→ 	Heavy infestation of semilooper observed in castor, so spray Chlorpyro phos 30 ml in 10 liters of water.
<b>Pulses</b>	Flowering & pod formation	Heliothis and prodenia 	<b>Heavy infestation of heliothis observed in pulses, so spray Beauveriabassiana40 gm in 10 liters of water or 250 larval unit of NPV solutionper acre. orrenaxypr 3 ml in 10 liters of water under clear sky.</b>
<b>Vegetables</b>	Transplanting	Transplanting of brinjal, chilli and early cauliflower are advised for those farmers whose seedlings are ready.	
<b>Lady's finger</b>	Flowering/ fruiting	Shoot and fruit borer  Mites	Spary neem seed extract 500 ml or neem seed oil 50 ml in 10 litre of water at 15 days interval(4 spray) Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised. Due to prevailing high temperature, light irrigation at short interval is advised.
<b>Brinjal</b>	Flowering/fru iting	<b>Sucking pest</b> & Fruit-shoot borer	To control them spray <b>neem seed extract</b> 5 % or neem seed oil 50 ml and <b>acetamiprid</b> 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval. Collect damaged fruits and buried deep in soil. If pest



		Mittes	population is high, spraying of renaxypyre @3 ml /10liters of water is advised. Spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised.
<b>Chili</b>	Flowering & fruiting	<b>Leaf curling</b> <b>Thrips</b>  <b>Virus</b> 	In present weather conditions severe attack of thrips has been reported. Spray 20 ml <b>profenofosin</b> 10 litres of water.  In present weather conditions, rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of Imidacloprid @ 5 ml per 10litre of water is advised for control the vector, when sky remains clear.
<b>Lemon</b>	Fruit development	Citrus canker Leaf minor	Spray copper oxychloride 40 gm or streptocyclie 1.5 gm in 10 litre of water Spray Dichlorvosh 10 ml or Quinalphos 20 ml in 10 litres of water for control of leafminor
<b>Livestock &amp; poultry</b> 	Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Deworming, T.B. and J.D. Testing should be done. Do Brucellous calfwood vaccination. Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. Due to chance of rainfall keep animals indoors during rainfall. Keep fodder in safe place to avoid spoilage due to rainfall. Ensure regarding vaccination of animals for different diseases in rainy season. Spray phenyl in the animal shed to avoid fly's and mosquitoes.		

**Technical Officer, GKMS Unit, DFRS, JAU, Targhadia.**